

શહેરમાં એક વર્ષમાં ટી.બી.ના ૧૭૩૮૪ કેસ જેમાં ૬૬૮ દર્દીનાં મોત

પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી, અસારવા, બહેરામપુરામાં ટીબીથી સૌથી વધુ મોત

ટી.બી.ના રોગનું નિર્મૂલન કરવાની જાહેરાત સાથે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક આયોજન હાથ ધરવામાં આવ્યા છે

અમદાવાદ, તા.૧૯ । અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ગંભીર રીતે વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી, અસારવા, બહેરામપુરામાં ટીબીથી સૌથી વધુ મોત સરકારી ચોપડે નોંધાય છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા તેમજ રમિયાલ વોર્ડમાં ટી.બી.ના રોગથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. નોંધનીય છે કે ભારતમાંથી વર્ષ-૨૦૨૧ સુધીમાં ટી.બી.ના રોગનું નિર્મૂલન કરવાની જાહેરાત સાથે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક આયોજન હાથ ધરવામાં આવ્યા છે. આમ છતાં હવાથી ફેલાતા ટી.બી.ના દર્દીઓ અને મોતની સંખ્યા અમદાવાદ જેવા શહેરમાં સતત વધી રહી છે એ બાબત તબીબો માટે ચિંતાનો વિષય બનવા પામી છે.

એક માહિતી અનુસાર ટી.બી. સંક્રમિત દર્દી જ્યારે ખાંસી કે છીંક ખાચ એ સમયે ટી.બી.ના ક્રીટાણુ ઝડપથી હવામાં ફેલાઈને અન્ય સાજા વ્યક્તિમાં પ્રવેશ કરતા હોય છે. લાલી સાથે ગળકાં પડવો, શરીરમાં સતત નખનાઈ લાગવી, વજન ઓછું થવું, રાતના સમયે પણ પરસેવો વળવો વગેરે ટી.બી.ના રોગના લક્ષણ છે.

બહેરામપુરા, ભાઈપુરા તેમજ રમિયાલ વોર્ડમાં ટી.બી.ના રોગથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે તેમ સરકારી ચોપડે થયેલી વિગતોથી જાણવા મળે છે.

નોંધનીય છે કે ભારતમાંથી વર્ષ-૨૦૨૧ સુધીમાં ટી.બી.ના રોગનું નિર્મૂલન કરવાની જાહેરાત સાથે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક આયોજન હાથ ધરવામાં આવ્યા છે. આમ છતાં હવાથી ફેલાતા ટી.બી.ના દર્દીઓ અને મોતની સંખ્યા અમદાવાદ જેવા શહેરમાં સતત વધી રહી છે એ બાબત તબીબો માટે ચિંતાનો વિષય બનવા પામી છે.

એક માહિતી અનુસાર ટી.બી. સંક્રમિત દર્દી જ્યારે ખાંસી કે છીંક ખાચ એ સમયે ટી.બી.ના ક્રીટાણુ ઝડપથી હવામાં ફેલાઈને અન્ય સાજા વ્યક્તિમાં પ્રવેશ કરતા હોય છે. લાલી સાથે ગળકાં પડવો, શરીરમાં સતત નખનાઈ લાગવી, વજન ઓછું થવું, રાતના સમયે પણ પરસેવો વળવો વગેરે ટી.બી.ના રોગના લક્ષણ છે.



ટી.બી.ના દર્દીઓને શોધી રોગ નિદાન માટે સોફ્ટવેરની મદદ લેવાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નીકળ્ય પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સર્વેની કામગીરી કરી ટી.બી.ના દર્દીઓને શોધી તેમનું નિદાન કરવાની સાથે સારવાર પણ આપવામાં આવી રહી છે. આ માટે સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી હેલ્થ વર્કર અને મેડીકલ સ્ટાફ તેમના વિસ્તારમાં આવેલા ટી.બી.ના દર્દીઓ તેને લેવાવાનું દવાનો ડોઝ લીધો કે નહીં એ બાબતથી લઈ તેના રોગ અંગેનું છેલ્લું રિપોર્ટ પણ જાણી શકે છે.

શ્રમીજીવી અને સ્લમ વિસ્તારોમાં ટીબીના દર્દીઓની નોંધપાત્ર સંખ્યા

શહેર મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવતા પ્રયાસની વચ્ચે પણ આ વર્ષે પબ્લિક સેક્ટરમાં ટી.બી.ના ૧૭૩૮૪ કેસ અને ૬૬૮ દર્દીના મોત નોંધાયા છે. માત્ર શ્રમ જીવી વસ્તી કે સ્લમ કે ચાલી વિસ્તારમાં જ ટી.બી.ના કેસ અને મોત નોંધાયા છે એવું નથી પરંતુ શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ ટી.બી.ના કેસ અને મોતની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

પૂર્વ વિસ્તારમાં ટીબીના દર્દીઓની સ્થિતિ



વોર્ડ	કેસ	મોત
અમરાઈવાડી	૯૭૭	૪૭
અસારવા	૧૧૬૪	૪૫
બાપુનગર	૫૪૮	૨૩
બહેરામપુરા	૧૧૪૮	૪૭
ભાઈપુરા	૬૯૯	૪૧
ઈન્ડિયા કોલોની	૬૮૪	૩૯
ઈસનપુર	૫૭૭	૩૨
નોબલનગર	૭૫૬	૩૧
રમિયાલ	૧૧૪૭	૪૨
સૈજપુર	૫૬૪	૧૭
વટવા	૭૩૧	૩૪
વિરાટનગર	૯૧૫	૨૪

ગુજરાતમાં ચાર વર્ષમાં ૪ ૧૨.૪૯ લાખ લોકોને શ્વાન કરડવાના બનાવ

પૂર્વ વિસ્તારમાં રખડતા શ્વાન અને કરડવાના વધતા બનાવથી ભય ફેલાયો

અમદાવાદ, તા.૧૯ । શહેરના પૂર્વ વિસ્તારમાં રખડતા શ્વાન અને કરડવાના વધતા બનાવથી ભય ફેલાયો છે. અહીં નરોડા, બાપુનગર, સરદારનગર, નિકોલ, કુબેરનગર, રમિયાલ, ઓઠવ, વટવા સહિતના વિસ્તારોમાં રખડતા શ્વાનો ઉપદ્રવ વધ્યો છે. સાથે સાથે શ્વાન કરડવાના બનાવ પણ વધ્યા છે. છેલ્લાં ઘણા સમયથી શહેરના પૂર્વ વિસ્તારમાં રસ્તા

ચાલનારાઓને કૂતરા કરડવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. અહીંના વિસ્તારોમાં રખડતા કૂતરા પકડવાની કામગીરીમાં વધારો કરવામાં આવે તેમ લોકો ઈચ્છે છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં કુલ ૧૨.૪૯ લાખથી વધુ લોકો કૂતરા કરડવાનો શિકાર બન્યા છે. આ પૈકી કૂતરા કરડવાની ૧.૪૪ લાખ ઘટના માત્ર આ વર્ષે જ નોંધાઈ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં

૪.૮૦ લાખ, ૨૦૨૦માં ૪.૩૧ લાખ, ૨૦૨૧માં ૧.૯૨ લાખ અને ૨૦૨૨માં ૧.૪૪ લાખ ઘટના નોંધાઈ છે. વર્ષ ૨૦૨૨માં નવેમ્બર સુધી કૂતરા કરડવાની ઘટના સૌથી વધુ નોંધાઈ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ડોક્ટરોના મતે કૂતરા કરડવાના મોટાભાગના કેસ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. આ ઉપરાંત ૭૭ ટકા કેસમાં કેટેગરી-૩નો ધાવ છે.

બાપુનગર, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં ગુનાખોરી વધી

નરોડાથી નારોલ સહિતના પટ્ટામાં લોનના નામે છેતરપિંડી

બારોબાર સહી કરીને બેંક ખાતાઓમાંથી નાણાં સેરવી લેવાના અનેક બનાવ સામે આવ્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોનના નામે બારોબાર નાણાં સેરવી લેવાના અને બેંકમાં ખાતેદારની જાણ બહાર સહી કરીને મોટી રકમ ઉપાડી લેવાના કિસ્સા પણ વધ્યા છે. સાર્થબર કાર્ટમ સહિતની ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા આયોજન માટે માંગણી થઈ રહી હોવાનું જાણવા મળે છે.

તાજેતરમાં શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નરોડા, નારોલ, રમિયાલ, કુબેરનગર, વટવા સહિતના વિસ્તારોમાં લોનના નામે નાગરિકો સાથે ઠગાઈ કરનારા ગેંગ સહિષ બની હોવાની ચર્ચા જાગી છે. તેને કારણે પોલીસની સતકતા

સાથબર કાર્ટમ સહિતની ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા આયોજન માટે માંગણી સામે પણ સવાલ થયો છે. નોંધનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં ૨૦૧૭ બેંક મેનેજર અને શખ્સે વેપારીની લોનની રકમ ખોટી સહીઓ કરીને રૂપિયા ૧૬ લાખ ઉપાડી લીધા હતા. મેનેજરે વેપારીના બેંક એકાઉન્ટમાં તેના હોદાનો દુરુપયોગ કરીને ૬૩ લાખનું ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું. પરંતુ વેપારીને લોનના રૂપિયા ન મળતા બેંક મેનેજર અને શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર પૂર્વ વિસ્તારના નારોલમાં રહેતા જિતેન્દ્ર

આરોપી પાસેથી ૯૭ જેટલી સિગરેટ કબજે પણ કરવામાં આવી છે. આરોપી પોતાના પાસે વેચવા પૂરનો જથ્થો રાખતો હતો. જ્યારે બાકીનો જથ્થો ધરે રાખતો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને સાર્થબર કાર્ટમ વધુ તપાસ હાથ ધરી છે.

દરમિયાન આરોપીની વધુ પુછપરછ કરતા વધારાનો જથ્થો પોતાના મકાનમાં છુપાવેલું હોવાનું જાણાયું હતું. જેથી પોલીસે આરોપીના ઘરે રેડ કરી હતી જ્યાં તપાસ કરતા અલગ અલગ ફલેવરની કુલ ૯૭ જેટલી ઈ સિગરેટ મળી આવી હતી. આ તમામ સિગરેટ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં આરોપી ગેરકાયદેસર રીતે ઈ સિગરેટનું વેચાણ કરતો હતો.

સોશિયલ મીડિયા મારફતે ઈ સિગરેટનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં મળ્યું હતું. સાથબર કાર્ટમ કુલ ૧,૪૭,૯૦૦ની સિગરેટ કબજે કરીને આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરીને ઈ સિગરેટ ક્યાંથી લાવતો હતો અને કોને વહેંચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા મારફતે ઈ સિગરેટનું વેચાણ થતું હોવાનું સાર્થબર કાર્ટમના ધ્યાને આવતા સાથબર કાર્ટમ દ્વારા આ પ્રકારે તપાસ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.

હવે જનતા પણ બ્રષ્ટાચારીઓને કરી શકશે બેનકાબ



LIVE
લોક પત્રિકા

આજે
Lok Patrika
એપ્લિકેશન ડાઉનલોડ
કરો અને જોડાઈ
જાઓ સમાચારની
દુનિયા સાથે

Lokpatrika.in
ન્યૂઝ પેપર | ન્યૂઝ ચેનલ | ન્યૂઝ વેબસાઈટ

GET IT ON Google Play





**CYBER SECURITY AND
ETHICAL HACKING
TRAINING IN AHMEDABAD**

**BECOME A CYBER SECURITY SPECIALIST
WITH FALGUN RATHOD**

Learn Ethical Hacking & Cyber Security

**WHY JOIN
CYBER
OCTET ?**

- ✓ LEARN MORE THAN 120 TOPICS UNDER ONE ROOF AT #CYBEROCTET
- ✓ TASK AND RESEARCH BASED TRAINING
- ✓ 100 % PLACEMENT ASSISTANCE
- ✓ LIVE PROJECTS
- ✓ INTERNATIONAL ACCREDITATION

TRAINING BY:-

**THE MOST EXPERIENCED TRAINER "MR.FALGUN RATHOD"
LISTED IN INDIA'S TOP 10 ETHICAL HACKERS AND CYBER
SECURITY EXPERT**

**ADVANCED DIPLOMA IN ETHICAL HACKING AND
CYBER SECURITY (1 YEAR)**

WHO CAN JOIN

STUDENTS

WORKING PROFESSIONALS

BUSINESS OWNERS

Contact Now

C-709, Titanium City Center, Prahladnagar road, Ahmedabad



91 7405321234



info@cyberoctet.com



www.cyberoctet.com



નવી દિલ્હી ખાતે શિયાળાની ઠંડી સવાર ગાઠ ધુમ્મસ વચ્ચે રસ્તા પર મુસાફરો જતા નજરે પડે છે.



ન્યૂઝ ફિક્સ



ઈન્ફોસિસના સ્થાપકનું વિવાદાસ્પદ નિવેદન

ભારતની વાસ્તવિકતા ભ્રષ્ટાચાર, ગંદા રસ્તા છે : નારાયણ મૂર્તિ

। નવી દિલ્હી, તા.૧૯ । આટી કંપની ઈન્ફોસિસના સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ જીએમઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતની વાસ્તવિકતા ભ્રષ્ટાચાર, ગંદા રસ્તા, પ્રદૂષણ અને ક્યારેક વીજળી નથી. જ્યારે, સિંગાપોરની વાસ્તવિકતા સ્વચ્છ રસ્તાઓ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને પુષ્કળ ઊર્જા છે. "તે નવી વાસ્તવિકતા બનાવવાની તમારી જવાબદારી છે," તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, જીએમઆર દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવ્યું હતું. વિજયનગરમ જિલ્લાના રાજમ ખાતે જીએમઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજત જયંતિ સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા, નારાયણ મૂર્તિએ કહ્યું કે દરેક ખામીને પરિવર્તનની તક તરીકે જોવી જોઈએ અને "એક નેતા તરીકે તમારી જાતની કલ્પના કરો, વ્યક્તિએ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કોઈની રાહ જોવી નહીં. નારાયણ મૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોએ સમાજમાં પરિવર્તન લાવવાની માનસિકતા કેળવવી જોઈએ, જાહેર જનતા,

હિન્દુ ધર્મ વિરુદ્ધ ફિલ્મ બનાવતા કલાકારોને ભિખારી બનાવી દો



। નવી દિલ્હી, તા.૧૯ । મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનારા કાલીચરણ મહારાજ ફરીથી ચર્ચામાં આયા છે. તેમણે આ વખતે બોલિવૂડ પર ઘા કર્યો છે અને વિવાદીત ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. સંત કાલીચરણે કહ્યું કે, ફિલ્મ પઠાન હોય કે અન્ય, આવી ફિલ્મો બનાવતા ડાયરેક્ટરને ભિખારી બનાવી દેવાની જરૂર છે. સંત કાલીચરણનું કહેવું છે કે, આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ, જે ધર્મ વિરુદ્ધ છે અને આવી ફિલ્મોના ડાયરેક્ટરને ભિખારી બનાવી દેવા જોઈએ. તેમણે આગળ કહ્યું કે, હું તમામ હિન્દુ ભાઈ બહેનોને આહ્વાન કરું છું કે હિન્દુ ધર્મનું અપમાન કરનારા જેટલા પણ ધર્મ દ્રોહી ફિલ્મ બનાવી રહ્યા છે, તેમનો પુરી તાકાત સાથે બહિષ્કાર કરવો જોઈએ અને આ તમામને સબક શિખવાડો કે, ધર્મનું અપમાન કરનારાઓને કેવી સજા મળે છે. કાલીચરણે કહ્યું કે, પઠાણ હોય કે, અન્ય ફિલ્મ આ તમામ ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ.

રાજધાની બેઈજિંગમાં ઓમિક્રોન વેરિએન્ટનો હાહાકાર ચીનમાં કોરોનાનો કાળો ફેર, સ્મશાનોમાં લાગી લાંબી લાઈન

અમેરિકા સ્થિત સંશોધન સંસ્થાએ આ સપ્તાહ કહ્યું કે દેશમાં કેસોનો વિસ્ફોટ થઈ શકે છે અને ચીનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે

। નવી દિલ્હી, તા.૧૯ । ચીનમાં કોરોનાનો પ્રકોપ ફરી જોવા મળી રહ્યો છે. તેને લીધે ચીનમાં ફરી એક વખત કોરોનાને લઈ લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારીને લીધે ફરી એક વખત મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોરોના મહામારીના વધતા પ્રકોપને લીધે બેઈજિંગમાં મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. સ્વજનોના મોત બાદ શનિવારે બેઈજિંગના સ્મશાનમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. લોકો અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં રડતા જોવા મળ્યા છે. બેઈજિંગના સૌથી મોટા સ્મશાન ઘાટ બાબોશાનની સ્થિતિ ખૂબ જ ડરાવનાર છે. અહીં પાર્કિંગ માટે જગ્યા રહી નથી. સ્મશાનમાં કામ કરનાર એક કર્મચારીએ જણાવ્યું કે અત્યારે શબયાત્રા માટે બુકિંગ કરાવવું મુશ્કેલ છે. લોકો પોતાના પરિવારજનો કે સંબંધીના મૃતદેહોને પ્રાર્થવેટ વાહનોમાં લઈ જઈ રહ્યા છે. અહીં સ્મશાનમાં સમગ્ર દિવસ દરમિયાન ધૂમાડો જ ધૂમાડો જોવા મળે છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે ચીનના ઉત્તર પશ્ચિમમાં આવેલ જ્યાન શહેરમાં સૌથી વધારે ખાલી જગ્યા છે. દેશના વાણિજ્ય કેન્દ્ર શાંઘાઈમાં પણ કિસમસ અને ન્યૂયરને લઈ કોઈ ખાસ ઉજવણી કે આનંદનો માહોલ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઉત્સવનો માહોલ નથી. લોકો આઘાતમાં છે. ચીનના ચેંગદૂમાં માર્ગો સુનસાન છે.

ફાઈનલમાં ફાન્સની હાર થતાં ફેન્સ ભડક્યા લોકોએ પેરિસના રસ્તા પર ઉતરીને તોડફોડ કરી

લ્યોન, નીસ અને રાજધાની પેરિસના રસ્તા પર ઉતરેલા ફુટબોલના ફેન્સે તોડફોડ કરી અને આગ લગાવી હતી



। પેરિસ, તા.૧૯ । કતરમાં થયેલા ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલમાં આર્જેન્ટિનાના હાથે મામૂલી અંતરથી હાર બાદ ફાન્સમાં ફુટબોલ પ્રશંસકોએ હોબાળો મચાવ્યો છે. લ્યોન, નીસ અને રાજધાની પેરિસના રસ્તા પર ઉતરેલા ફુટબોલના ફેન્સે તોડફોડ કરી અને આગ લગાવી હતી. પોલીસની સાથે પણ ઝપાઝપી થઈ હતી. ઉપદ્રવીઓને કાબૂ કરવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. દસનાના એક રિપોર્ટ અનુસાર, પેરિસમાં ફેમસ ચેમ્પ્સ એલિસીઝ પર રમખાણોને કાબૂ કરવા માટે પ્રશંસકોની સાથે અથડામણ થઈ હતી. કારણ કે તણાવપૂર્ણ રમત બાદ ફેલ્પર્સ સળગાવ્યા અને આકાશમાં આતશબાજી કરી હતી. ફુટબોલ વિશ્વ કપ ફાઈનલમાં જીતની આશામાં હજારો પ્રશંસક પેરિસ અને અન્ય ફ્રાંસીસ શહેરોમાં જમા થયા હતા. પણ તેમની રાષ્ટ્રીય ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાના હાથે ૪.૨થી હારી ગઈ હતી.

દેશના સૈનિકોનું અપમાન ન કરવું જોઈએ : એસ.જયશંકર

। નવી દિલ્હી, તા.૧૯ । દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે લોકસભામાં કહ્યું કે રાજકીય ટીકા હંમેશા આવકાર્ય છે, પરંતુ આપણે આપણા સૈનિકોનું અપમાન ન કરવું જોઈએ. એસ જયશંકરે કહ્યું, "મેં સાંભળ્યું છે કે વિદેશ મંત્રી તરીકે મારે મારી સમજણને વધુ ગાઠ

બેન્કોએ ખાલી લોકરની સંખ્યા અને લોકરના વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરવી પડશે

। નવી દિલ્હી, તા.૧૯ । આગામી વર્ષના પહેલા જ દિવસથી બેન્કોને લગતા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી બેન્ક લોકરના નિયમોમાં મોટા ફેરફાર થશે અને ગ્રાહકોએ નવેસરથી બેન્ક સાથે એગ્રીમેન્ટ કરવા પડશે. અત્યાર સુધી લોકરના મામલે બેન્કો વધારે પડતી મનમानी કરતી હતી અને ગ્રાહકોને પરેશાન કરતી રહી છે. પરંતુ હવે બેન્કોની જવાબદારીમાં વધારો થશે અને આ પ્રક્રિયા વધારે પારદર્શક બનશે. એસબીઆઈ અને પીએનબી સહિત ઘણી બેન્કોએ ગ્રાહકોને એસએમએસ દ્વારા નવા નિયમોની માહિતી આપવાની શરૂઆત કરી છે. આરબીઆઈએ જણાવ્યું છે કે બેન્કોએ ખાલી લોકરની સંખ્યા અને લોકરના વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરવી પડશે. બેન્કો વધુમાં વધુ ત્રણ વર્ષ માટે એક સાથે લોકરનું ભાડું વસુલી શકશે ધારો કે લોકરનું વાર્ષિક ભાડું ૧૫૦૦ રૂપિયા હોય તો બેન્કો અન્ય ચાર્જિસને બાદ કરતા ગ્રાહક પાસેથી ૪૫૦૦ રૂપિયા કરતા વધારે વસુલ નહીં કરી શકે. બેન્કો ઘણી વખત ગ્રાહકોને અયોગ્ય શરતો માનવા માટે મજબૂર કરે છે. પરંતુ હવે એવું નહીં ચાલે. બેન્કો પોતાની જવાબદારીમાંથી છટકી જાય તેવી શરતો નહીં રાખી શકે. એસબીઆ સુજબ લોકરના ચાર્જ પણ હવે બદલાશે. હાલમાં લોકરની સાર્વજનિક આધારે તેનો ચાર્જ વાર્ષિક ૫૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધી હોય છે. મોટા શહેરો અને મેટ્રો સિટીમાં આ ચાર્જ ૨૦૦૦ રૂપિયાથી લઈને ૧૨,૦૦૦ રૂપિયા સુધી હોય છે.

રાજકારણના ચતુર ખેલાડીએ ફરી કેન્દ્રને ફસાવી આના કારણે અર્થવ્યવસ્થા મજબૂત થશે એવો નેતાનો દાવો, કેજરીવાલની આ માગનો તો કદાચ જ કોઈ વિરોધ કરી શકે

ભારતીય પ્રોડક્ટ ખરીદવા કેજરીવાલની લોકોને અપીલ

। નવી દિલ્હી, તા.૧૯ । રાજકારણના ચતુર ખેલાડી બની ચુકેલા અરવિંદ કેજરીવાલ ઘણીવાર એવી માંગો કરે છે, જે કોઈ સરકાર માટે પણ પૂર્ણ કરવી અસંભવ છે. જોકે આ માંગોના કારણે કેજરીવાલ ચર્ચાના કેન્દ્રમાં આવી જાય છે. ગત દિવસોમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારને ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીની તસવીરો અંકિત કરવાની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આમ કરવાથી દેશની અર્થવ્યવસ્થા વધુ સારી બનશે. કેજરીવાલની આ માંગને હિન્દુ કાર્ડ તરીકે જોવામાં આવી હતી. જોકે આ મુદ્દે અર્થવ્યવસ્થાના નિષ્ણાંતોએ કેજરીવાલના આ નિવેદનને વાલિયાત ગણાવી હતી. તે કેજરીવાલે ફરી એકવાર એવી ગુગલી ફેંકી છે કે, જેનો વિરોધ ભાજપ અથવા આરએસએસથી આવે, તો ભારતે આવી પ્રોડક્ટો ચીનમાંથી આયાત કરવી નહીં પડે અને ચીન સહિત વિદેશોમાં આવી પ્રોડક્ટોની નિકાસ પણ કરવા લાગશે. તેમણે લોકોને અપીલ કરી છે કે, ચાર્ટર્ડ પ્રોડક્ટ ન ખરીદો, ભારતીય પ્રોડક્ટ બે ઘણી કિંમતની હોવા છતાં લોકો સ્વદેશી પ્રોડક્ટ જ ખરીદો. આના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. કેજરીવાલની આ માંગનો કદાચ જ કોઈ વિરોધ કરી શકે. જોકે અર્થવ્યવસ્થાના નિષ્ણાંતોનું માનવું છે કે, હાલ ભારત ચીનની પ્રોડક્ટોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સ્થિતિમાં નથી. આર્થિક બાબતોના નિષ્ણાંત ડૉ.નાગેન્દ્રકુમાર શર્માએ અગ્રણી મીડિયા જૂથને માહિતી આપતા કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે ચીનમાંથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાના બિન-જરૂરી સામાનની આયાત કરાય છે.

થાઈલેન્ડની ખાડીમાં તેજ પવનને લીધે દુર્ઘટના રોયલ નેવીએ ત્રણ જહાજો અને મોબાઇલ પમ્પિંગ મશીનો સાથે બે હેલિકોપ્ટર જહાજના પાણીને દૂર કરવા મોકલ્યા

થાઈલેન્ડ નેવીનું જહાજ દરિયામાં ડૂબ્યું : ૩૧ ગુમ

। બેંગકોક, તા.૧૯ । રવિવારે થાઈલેન્ડ નેવીનું એક જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. જહાજમાં ૧૦૦ થી વધુ લોકો સવાર હતા. ૭૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ૨૫ હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, રોયલ થાઈ નેવીનું એચટીએમએસ સુખોથાઈ કોવેટ રવિવારે સાંજે થાઈલેન્ડની ખાડીમાં તેજ પવન અને દરિયાઈ મોજાને કારણે ડૂબી ગયું હતું. રાહત અને બચાવ માટે જહાજો અને હેલિકોપ્ટર તેનાત કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ રોયલ નેવીએ ત્રણ જહાજો અને મોબાઇલ પમ્પિંગ મશીનો સાથે બે હેલિકોપ્ટર જહાજના પાણીને



